

Dr. Babasaheb Ambedkar Open University, Ahmedabad

Term-End Examination: January-2026

Course Name : MCOM

Date : 19-02-2026

Subject Name : નાણાકીય બજારો અને સાધનો (Financial Markets and Instruments)

Time : 03:00PM TO 05:15PM

Subject Code : MC01EC103

Max Marks : 70

પ્રશ્ન-1. નીચેનામાંથી કોઇપણ એક પ્રશ્નનો જવાબ આપો. (14)

- (1) નાણાંબજારનો અર્થ સમજાવી તેના ઘટકો સમજાવો.
(2) સામાન્ય વીમો એટલે શું? સામાન્ય વીમામાં ક્યાં ક્યાં વીમાનો સમાવેશ થાય છે. વીમાના મધ્યસ્થીઓ અને તેમના મુખ્ય કાર્યની માહિતી આપો.

પ્રશ્ન-2. નીચેનામાંથી કોઇપણ એક પ્રશ્નનો જવાબ આપો. (14)

- (1) નવા ભરણા માટે નિમાયેલા લીડ મેનેજરના કાર્યો વિશે સમજૂતી આપો.
(2) વિકાસ બેંકના પ્રકારો વિશે વિસ્તૃત ચર્ચા કરો.

પ્રશ્ન-3. નીચેનામાંથી કોઇપણ એક પ્રશ્નનો જવાબ આપો. (14)

- (1) CBLO નો અર્થ આપી તેના વિશે વિસ્તૃત ચર્ચા લખો.
(2) ચોક્કસ સમયગાળાનાં મ્યુચ્યુઅલ ફંડનાં લક્ષણો જણાવો.

પ્રશ્ન-4. નીચેનામાંથી કોઇપણ એક પ્રશ્નનો જવાબ આપો. (14)

- (1) ભારતમાં ડેડિટ રેટિંગ એજન્સીના પ્રકારો વિશે સવિસ્તાર સમજાવો.
(2) સેબીની મ્યુચ્યુઅલ ફંડ વિશેની માર્ગદર્શિકા ચર્ચો.

પ્રશ્ન-5. ટૂંકનોંધ લખો (કોઇપણ ત્રણ) (9)

- (1) વિકાસ બેંકની ભૂમિકા
(2) IRDAના મુખ્ય ઉદ્દેશો
(3) ગૌણબજારના કાર્યો
(4) નાણાં બજારનાં લક્ષણો
(5) સ્ટોડિયાના પ્રકાર

પ્રશ્ન-6. સાચો વિકલ્પ પસંદ કરો. (5)

(1) કયા વર્ષથી કોમર્શિયલ પેપરનો અમલ થયો ?

- A) 1987 B) 1988
C) 1989 D) 1990

(2) ઇ.સ.માં બોમ્બે મ્યુચ્યુઅલ લાઈફ ઇન્સ્યુરન્સ નામની, પ્રથમ ભારતીય કંપની દ્વારા વીમો આપવાની શરૂઆત કરવામાં આવી.

- A) 1960 B) 1870
C) 1965 D) 1975

(3) આ વીમો તબીબી સંભાળની કિંમતની ચુકવણી સામે કવચ પૂરું પાડે છે.

- A) નિવૃત્તિ વીમો B) બાળવીમો
C) આરોગ્ય વીમો D) મુસાફરીવીમો

(4) જ્યારે કંપનીએ જનતાને શેર આપી દીધા છે તે ફરીથી જનતાને આમંત્રણ આપે તેને કહે છે.

- A) જાહેર ભરણું B) ફરીથી જાહેર આમંત્રણ
C) બાંચધરી દલાવો D) ગૌણબજાર

(5) મ્યુચ્યુઅલ ફંડના રોકાણની પદ્ધતિ નિશ્ચિત આવક આપતી કઈ સિક્યોરિટી હેઠળ છે?

- A) ગ્રોથ ફંડ યોજના B) સંતુલિત ભંડોળ યોજના
C) આવક ભંડોળ યોજના D) મની માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ યોજના
